



અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ

સરદાર વલ્લભભાઈ પટેલ સંકુલ, ઉસ્માનપુરા, આશ્રમરોડ, અમદાવાદ-14
ફોન : (ઓફિસ) 27545051 - 54. ફેક્સ : (079)-27545061
ઈ મેઇલ : auda_urban@yahoo.co.in વેબસાઇટ : www.auda.org.in



FORM: D

નમુનો: ધ

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો ૧૯૭૯, નિયમ-૧૦

વિકાસ માટે પરવાનગી

શ્રી VIMLA SHELTERS PVT.LTD. PARMINDARSINGH S. CHHABDA/DAFFODIES TOWER, SANAND GAM, SANAND-382110. ને

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976 (સન. 1976 ના રાષ્ટ્રપતિ અધિનિયમ નં 27) ની કલમ-29 (1)(i), 29(1) (ii), 49(1) (b) હેઠળ મોજે ગામ SANAND તાલુકો SANAND જિલ્લો AHMEDABAD નગર રચના યોજના નં. T.P.5(SANAND) રે.સ.નં./બ્લોક નં 2006/P હિસ્સા નં --

મુળખંડ નં 216/1 અંતિમખંડ નં 216/1 સબપ્લોટ નં --- ટેનામેન્ટ નં --- ની 1367.00 ચો.મી જમીનમાં તેમની હદમાં નીચે વર્ણન કર્યા પ્રમાણે આ સાથેની શરતોને આધીન વિકાસ પરવાનગી આપવામાં આવે છે.

બિલ્ડિંગ ટાઇપ : Residential Affordable Housing કામનું વર્ણન:

અ.નં. (1)	માળ (2)	બાંધકામ(બિલ્ડઅપ)નું ઉપયોગી ક્ષેત્રફળ (ચો.મી.) (3)	બાંધકામનો ઉપયોગ (4)	એકમની સંખ્યા (5)	રિમાર્ક (6)
1	સેલર/બોયરુ (૧)	770.95	PARKING	---	Residential Affordable Housing
2	ગ્રાઉન્ડ ફ્લોર (ફોલોપ્લીનથ)	396.09	PARKING	---	
3	ફર્સ્ટ ફ્લોર	376.66	RESIDENTIAL	04	F.S.I ON PAYMENT:1227.72 SQ.MT
4	સેકન્ડ ફ્લોર	376.66	RESIDENTIAL	04	
5	થર્ડ ફ્લોર	376.66	RESIDENTIAL	04	
6	ફોર્થ ફ્લોર	376.66	RESIDENTIAL	04	
7	ફીફ્થ ફ્લોર	376.66	RESIDENTIAL	04	
8	સીક્સથ ફ્લોર	376.66	RESIDENTIAL	04	
9	સેવેનથ ફ્લોર	376.66	RESIDENTIAL	04	
10	એઈટથ ફ્લોર	376.66	RESIDENTIAL	04	
11	નાઈનથ ફ્લોર	376.66	RESIDENTIAL	04	
12	ટેનથ ફ્લોર	376.66	RESIDENTIAL	04	
13	ઇલેવેન ફ્લોર	376.66	RESIDENTIAL	04	
14	ટુવેલ્વ ફ્લોર	376.66	RESIDENTIAL	04	
15	થર્ટીન ફ્લોર	---	---	---	
16	ફોર્ટીન ફ્લોર	---	---	---	
17	સ્ટેર કેબીન	170.87	---	---	
18	મશીન રૂમ	45.72	---	---	
	કુલ:	5803.55	PARKING+RESIDENTIAL	48	

CONDITIONS: (1) THIS APPLICATION IS MADE ON ODPS WIDE APPLICATION ID:993279 AND FINAL PAYMENT IS MADE ON ONLINE SYSTEM WIDE RECEIPT NO:1138740 DT:11/10/2018 (2)AS PER THE CIRCULAR OF GOVERNMENT OF GUJARAT DATED: DT:25/09/2018 APPLICANT HAS SUBMIT DRAWING FILE IN THE PRESCRIBE FORMAT FROM THE DATE OF APPROVAL WITHIN 15 DAYS (3)AS PER THE CIRCULAR OF GOVERNMENT OF GUJARAT DATED: DT:25/09/2018 APPLICANT HAS SUBMIT DRAWING FILE IN THE PRESCRIBE FORMAT FROM THE DATE OF APPROVAL WITHIN 15 DAYS (4)FIRE NOC SHALL BE PRODUCED & FIRE PROTECTION CONSULTANT SHALL BE APPOINTED BEFORE OBTAINING BUILDING USE PERMISSION. (5)ACCORDING TO THE NOTIFICATION OF THE GOVERNMENT DATED. 15/6/2016, BEFORE GETTING THE B.U PERMISSION, IT IS REQUIRED TO SUBMIT THE NECESSARY INSURANCES.

રિવાના કર્યું, મારફત

3 NOV 2018

આ.ઉ.એફ.વી નં:

ક્રમાંક: IFP-993279/8/2018/418

તારીખ: 26/10/2018

મદદનીશ નગર નિયોજક

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ

અમદાવાદ.

સીનિયર નગર નિયોજક

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ

અમદાવાદ

ખાસ શરતો:-

- ૧ આ વિકાસ પરવાનગીથી જી.ડી.સી.આર ના વિનિયમ નં. ૩૦ મુજબ તેમજ અન્ય લાગુ પડતા કાયદા/નિયમો અન્વયેની પરવાનગીઓ મળતી નથી.
- ૨ વિકાસ પરવાનગી મેળવ્યા બાદ સ્થળ ઉપર વિકાસ શરૂ કરતા પહેલા સાત દિવસ અગાઉ ક્લોમ નં.2(D) નું એનેક્સર, સ્ટ્રક્ચરલ ડ્રોઇંગ્સ, વકીંગ ડ્રોઇંગ્સ તથા સોઈલ ઈન્વેસ્ટીગેશન રીપોર્ટ નિયમાનુસાર રજૂ કરવાના રહેશે.
- ૩ બાંધકામ નીચેના દરેક તબક્કે ફ્રોમ નં ૧૦ માં દર્શાવેલ મુજબ કમેન્સમેંટ રીપોર્ટ તથા ફ્રોમ નં ૧૧ માં દર્શાવ્યા મુજબનું પ્રોગ્રેસ સર્ટીફિકેટ રજૂ કરવાનું રહેશે અને સત્તામંડળ તરફથી પરવાનગી મેળવ્યા બાદ જ આગળના તબક્કાનું બાંધકામ શરૂ કરવાનું રહેશે. અ. પ્લોટ અથવા ભોયરાનું બાંધકામ હોય તો ભોયરા ઉપરનો સ્લેબ ભરવામાં આવે તે પહેલાં બ. પ્રથમ માળના ક. બહુમાળી મકાનમાં વચ્ચેના માળના બાંધકામ વખતે ડ. છેલ્લા માળના બાંધકામ વખતે
- ૪ જી.ડી.સી.આર ની જોગવાઈ તથા સરકારશ્રીના તા.૨૯-૫-૨૦૦૧ ના સ્ટ્રક્ચરલ સેફ્ટી અંગેના હુકમના વિનિયમ નં.૩ અનુસાર બાંધકામના સ્થળની જરૂરિયાતોની જોગવાઈઓનું પાલન થયેથી સ્થળ ઉપર બાંધકામ શરૂ કરવાનું રહેશે.
- ૫ સેપ્ટીક ટેંક તથા સોકવેલની સાઈઝ તથા સંખ્યા નેશનલ બિલ્ડીંગ કોડ (આઈએસ ૨૪૭૦) તથા જી.ડી.સી.આર ના વિનિયમ નં.૨૩.૧૦.૧ મુજબ સીવરેજ ના નિકાલની વ્યવસ્થા કરવાની રહેશે. તે અનુસારની જોગવાઈ કરવાની જવાબદારી આક્રીટેકટ/ઈજનેર/ સ્ટ્રક્ચરલ એન્જીનીયર/કલેક ઓફ વકેસ/સાઈટ સુપરવાઈઝર/ડેવલપર/જમીન માલિકની રહેશે.
- ૬ ચીફ ક્વૉટર ઓફિસરશ્રી, અ. મ્યુ.કોપો. ના અભિપ્રાય મુજબ તમામ નિયમો અને શરતોનો સુસ્તપણે અમલ કરવાનો રહેશે.
- ૭ ટેલીકોમ્યુનિકેશન ડીપાર્ટમેન્ટની જોગવાઈ મુજબ ટેલીકોનની સુવિધા માટે ખાસ જોગવાઈ જમીન માલિકે કરવાની રહેશે.
- ૮ જી.ડી.સી.આર. વિનિયમ નં.૬.૨ તથા ૬.૩ મુજબની તમામ માહિતી સ્થળ ઉપર (નોટીસ બોર્ડ) પ્રસિધ્ધ કરવાની રહેશે.
- ૯ બાંધકામ પૂર્ણ થયા બાદ બાંધકામનો ઉપયોગ શરૂ કરતા પહેલા નિયમાનુસાર અત્રેથી બાંધકામનું વપરાશ અંગેનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ વપરાશ શરૂ કરવાનો રહેશે.
- ૧૦ ૧.ફા.ટી.પી. સ્કીમ સરકાર શ્રી દ્વારા મંજૂર થયેલ, ટી.પી.ઓ.દ્વારા નિર્ણય લેવામાં આવશે તે બાંધકામ કરવાની રહેશે. ૨.રેલવેથી ૩૦.૦ મી. કન્ડ્રોલ લાઈનમાં આવતાં મકાનોનું બી.યુ. પરમીશન લેતાં પહેલાં રેલવેથી ૩૦.૦ મી. C લાવવાની રહેશે.
- ૧૧ જી.ડી.સી.આર વિનિયમ નં.૨૬.૧, ૨૬.૨ તથા ૨૬ મુજબ અરજદારશ્રી/ડેવલપરશ્રી/કબજેદારશ્રી ઓ એ વસવાનું રહેશે.

શરતો:-

- ૧ વિકાસ પરવાનગી પત્રમાં દર્શાવેલ શરતોનો ભંગ કરવામાં આવશે તો સત્તામંડળ તે શરતોનો અમલ જવાબદાર ઈસમના/સંસ્થાના ખર્ચે અને જોખમે કરાવી શકશે અને સત્તામંડળના તેવા કૃત્યને લીધે જે નુકશાન, ખોટ કે ફરક થાય તે બદલ કોઈપણ વળતર કે બદલો મળશે નહીં.
- ૨ વિકાસ પરવાનગીના કારણે અરજદારને જી.ડી.સી.આર ૩.૩ (a,b,c,d,e) અંગેની મંજૂરી મળતી નથી પરંતુ બાંધકામ અંગેની મંજૂરી આપવામાં આવે છે.
- ૩ વિકાસ પરવાનગીથી ખાનગી હક્કો અંગે સત્તામંડળની નોંધણી જવાબદારી રહેતી નથી.
- ૪ મુસદ્દા રૂપ નગર રચના યોજનામાં ફાળવવામાં આવેલ સત્તામંડળની હદ, માપ, મેટ્રિક્સ તથા ફાળવણી ટાઉન પ્લાનની જોડીસરશ્રી દ્વારા ફેરફારને પાત્ર છે.
- ૫ પ્લોટની હદ, આંતરિક રસ્તા ઉપર, કોમન પ્લોટમાં કોઈને અંતરય રૂપ ન થાય, તે રીતે યોગ્ય સ્થળોએ ૨૦૦.૦૦ ચોરસ મીટર જમીનમાં વિસ્તાર દીઠ ત્રણ વૃક્ષ (જી.ડી.સી.આર શેડયુલ ક્રમાંક-૨૪ મુજબના) ઉગાડવાના રહેશે. વૃક્ષો ની ફરતે જરૂરીયાત મુજબ ટી ગાર્ડ રાખી વૃક્ષો ની સીરસલાળ રાખવાની જવાબદારી જમીન માલિક તથા વિકાસ પરવાનગી મેળવનારની રહેશે.
- ૬ લેઆઉટમાં દર્શાવેલ આંતરિક રસ્તાઓ પાકા કરવાના રહેશે.
- ૭ વખતો વખત શહેરી વિકાસ સત્તામંડળ તરફથી વિકાસ માટેના જે નિયમો તથા જાહેરાત ફેરવાય તે જમીન માલિક, હિતસંબંધ ધરાવતી વ્યક્તિ/સંસ્થા તેમજ અરજદારને બંધનકર્તા રહેશે.
- ૮ સદર વિકાસ પરવાનગી અન્વયે જમીન માલિકીમાં ફેરફાર થાય અથવા આ પરવાનગી સાથે સંકળાયેલ રજીસ્ટ્રેશન ધરાવતી કોઈ વ્યક્તિ બદલાય તો નવા જમીન માલિક અંગેના પુરાવા રજૂ કરે ત્યાં સુધી તથા રજીસ્ટ્રેશન ધરાવતી નવી વ્યક્તિની નિમણૂક ન થાય ત્યાં સુધી જી.ડી.સી.આર /જીડીઆર ના વિનિયમ ૪.૬/૪.૭ મુજબ વિકાસ પરવાનગી નિલબીત ગણાશે. સદરૂઢ સમય દરમિયાન થયેલ બાંધકામ બિનાધિકૃત ગણાશે.
- ૯ સરકારશ્રીના તા.૨૯-૫-૨૦૦૧ ના સ્ટ્રક્ચરલ સેફ્ટી અંગેના એનેક્સર XI ના વિનિયમ ૧૩,૧૪,૧૫ ની જોગવાઈ અનુસાર ભૂકંપ અંગેની સુરક્ષા, ચક્રવાત અંગેની સુરક્ષા, બાંધકામ તથા બાંધકામમાં વપરાતા ઈમારતી માલ સામાનની ગુણવત્તા અને તેની ચકાસણી, બાંધકામની સ્થિરતા તથા આગ અંગેની સલામતી તેમજ અન્ય ભયજનક બાબતે અંગે નિષ્ણાતોની સલાહ સૂચન મુજબ પગલા લેવાની તમામ જવાબદારી આક્રીટેકટ/ઈજનેર/ સ્ટ્રક્ચરલ એન્જીનીયર/કલેક ઓફ વકેસ/સાઈટ સુપરવાઈઝર/ડેવલપર/જમીન માલિકની રહેશે. આ અંગે સત્તામંડળ ની કોઈ જવાબદારી રહેશે નહીં.
- ૧૦ આ વિકાસ પરવાનગી મેળવવાની આખ્યા તારીખથી બાર માસ સુધીજ અમલમાં રહેશે. ત્યારબાદ અધિનિયમની કલમ-૩૨ મુજબ વિકાસ પરવાનગીની મુદત વધારવાની પૂર્વ મંજૂરી મેળવી લેવાની રહેશે.
- ૧૧ ગુજરાત નગર સમાવેશ અંગેની વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૩૩ મુજબ વિકાસ યોજનામાં જો કોઈ ફેરફાર થાય તો સત્તામંડળ આપેલ વિકાસ પરવાનગીમાં ફેરફાર કરી શકશે અથવા વિકાસ પરવાનગી રદ કરી શકશે.
- ૧૨ જી.ડી.સી.આર /જીડીઆર ના વિનિયમ ૪.૬/૪.૭ મુજબ અરજદારશ્રીએ ખોટી રજૂઆત અથવા ખોટા દસ્તાવેજ પુરાવા રજૂ કરેલ હશે તો આપેલ વિકાસ પરવાનગી આપો આપ રદ થયેલ ગણાશે.



3 NOV 2018

આઈ એફ ઓ નં:
ક્રમાંક: IFP-993279/8/2018/418
તારીખ: 26/10/2018

મદદનીશ નગર નિયોજક
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ
અમદાવાદ.

સીનીય નગર નિયોજક
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ
અમદાવાદ

Ahmedabad Urban Development Authority

FORM NO. D.

DEVELOPMENT PERMISSION

Date :24/10/2018

Permission is hereby under Section 29(1) (i)/29(ii)/29(1)(iii), 34, 49(1)(b) of the Gujarat Town Planning and Urban Development Act, 1976 / under Section 253 and 254 of Gujarat Provincial Municipal Corporation Act, 1949.

Case No:993279

Rajachitthi No:AUDA/11-10-2018/993279/02/000144

For: Residential

District:Ahmedabad

Taluka: Sanand

Village: Sanand

Final Plot No.: 216/1

Arch/Engg. No: ENGG/369

Arch/ Engg. Name: Shah Nitesh Jashwantlal

Name of Applicant :DIRECTOR OF VIMALA SHELTERS PRIVATE LIMITED , PARMINDAR SINGH S. CHHABDA

Address :DAFFODILS TOWER , SANAND GAM , SANAND , Sanand Ahmedabad Gujarat

Land Description: OPEN LAND

Sub Plot No.:

TP Scheme: 5 (sanand)

TP Scheme No.: 5

Proposed Final Plot No: 216/1

On the following conditions/grounds

Conditions:

Conditional Remarks:- 1-As Per the circular of Government Of Gujarat dated: Dt:25/09/2018 Applicant has

submit .Dwg file in the Prescribe format from the date of approval within 15 Days
2- Village:SANAND, D.T.P.S No:5(SANAND) ,SUR No:2006/A,O.P NO:216/1,F.P No:216/1
Zone:RESI-I USE: RESIDENTIAL AFFORDABLE HOUSING (RAH) Building Unit, Built Up Area And Land Use should to Be Considered As Per Building Layout plan Instead Of Generated in Form-D,

3-FIRE NOC shall be produced & fire protection consultant shall be appointed before obtaining BUILDING USE permission.

4-According to the notification of the government dated. 15/6/2016, before getting the B.U permission, it is required to submit the necessary insurances

For The Chief Executive Authority / Municipal Commissioner /Chief Officer
Ahmedabad Urban Development Authority

GRANT OF THE PERMISSION IS SUBJECT TO THE FOLLOWING CONDITIONS

1. The remaining payments are to be made online within seven days and only thereafter this permission shall be considered to be valid and shall be valid for 12 months.
2. The permission granted does not absolve the owner from any the liabilities or the permissions required under any other act.
3. The permission does not constitute the acceptance of correctness, confirmation, approval or endorsement of:
 - a. Title, ownership, and easement rights of the Buildingâ€unit for which the building is proposed;
 - b. The area, dimensions and other properties of the plot which violate the plot validation certificate.
 - c. Correctness of demarcation of the plot on site.
 - d. Workmanship, soundness of material and structural safety of the proposed building;
 - e. Structural reports and structural drawings and shall not bind or render the Competent Authority liable in any way in regard to (a), (b), (c) (d), (e) and (f) above.
4. The applicant, as specified in CGDCR, shall submit:
 - a. Structural drawings and related reports, before the commencement of the construction,
 - b. Progress reports.
5. Follow the requirements for construction as per regulation no 5 of CGDCR.
6. The permission has been granted relying uploaded submissions, undertakings, attachments of true copies of the original documents made along with the online application. It is believed that the aforesaid data uploaded by the owner or the applicant is true and legally valid. Also the plans are as per the prevailing Comprehensive General Development Control Regulation-2017

In case of any discrepancy/lack of authenticity of the data found in the aforesaid declaration or in the attachments, or violation of any conditions, the application shall automatically stand cancelled/revoked and the construction/ development carried out shall be considered illegal and unauthorized and the competent authority may take legal action to pull down illegal construction, action to discontinue further construction and or the use of building, and or other legal actions including initiating criminal proceedings. Consequent damage or loss on account of aforesaid shall be at the cost of the owner or the applicant. Also, the owner or applicant shall have no right for any claim or damages on account of any action by the competent authority.

Order Number :AUDA/11-10-2018/993279/02/000144

Order Date :11/10/2018

Subject to the submission of detailed working drawings, and structural drawing(s) along withsoil investigation report before the commencement of the work.

